

પોલીસ અધિક્ષકની કચેરી, નવસારી.

નવસારી જીલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ સારી કામગીરીની વિગત  
સાફલ્યગાથા તા.૨૭/૦૧/૨૦૨૦ થી ૦૨/૦૨/૨૦૨૦

વિક દરમ્યાન કરેલ સારી કામગીરીની માસમાં નવસારી પોલીસે કરેલ સારી કામગીરી(સાફલ્યગાથા)ની વિગત.

અ.નં	સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી	કરેલ સારી કામગીરીની વિગત	રીકવર કરેલ મુદામાલ
------	--------------------------------------	--------------------------	--------------------



## નવસારી જીલ્લા પોલીસ

નવસારી જીલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ અધિકારી તથા એલ.આઈ.બી.માં કામ કરતા કર્મચારીઓને તા.૩/૧/૨૦૨૦ના રોજ પોલીસ અધિક્ષકશ્રી, નવસારીની કચેરીએ બોગસ ભારતીય પાસપોર્ટ અને બોગસ અમેરીકન વિઝાની છેતરપીંડી તથા ખોટું નાગરીકત્વ ધારણ કરનાર વ્યક્તિઓના કિસ્સામાં દાખલ થતા ગુન્હાઓને લગતી તપાસના મુદ્દાઓ અનુલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોન્સુલેટ જનરલ ઓફ અમેરીકાના દુતાવાસના કાર્લમ ફોડ ઈન્વેસ્ટીગેશન, વિભાગીય સુરક્ષા અધિકારીશ્રી બ્રેડોન-શો તથા શ્રી હરજી સાપરીયાનાઓ દ્વારા પાસપોર્ટ તથા વિઝાની ખરાઈ કરવા વિવિધ સુક્ષ્મદર્શક સંશોધનો દ્વારા તાલીમ આપવામાં આવેલ છે.



## નવસારી જીલ્લા પોલીસ

નવસારી જીલ્લા એલ.સી.બી. પો.ઈન્સ. તથા સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા ચીખલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચીખલી પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં. ૭૫૪/૨૦૧૯માં નાસતો ફરતો વીન્ટેડ આરોપી મહમદ જુનેદ અબ્દુલ જબ્બાર શેખ રહે.વલસાડ મોગરાવાડીનાને ખેરગામ રોડ ઉપરથી પકડી પાડી ચીખલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ.



## નવસારી જીલ્લા પોલીસ

નવસારી જીલ્લા એલ.સી.બી. અને પેરોલ ફ્લો પોલીસ સ્ટાફ પ્રોહીબીશન પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી ભાવેશભાઈ શેલેષભાઈ, રહે.નાની તંબાડી, સંજી ફળિયા, તા.વાપી, જી.વલસાડ નાને બલવાડા-ઉંડાય રોડ પરથી નિશાન માઈકા કાર નંબર:જીજી-૧૫-સીબી-૧૭૪૬માં ભારતીય બનાવતની વિદેશી દારૂની બારલીઓ નંગ-૧૯૧ કી.રૂ.૧,૨૦,૫૦૦ અને કારની કિંમત રૂ.૪,૦૦,૦૦૦ તથા મોબઈલ ફોન-૨ કી.રૂ.૪,૦૦૦ મળી કુલ કિં.રૂ.૦૫,૨૪,૫૦૦ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ બિલીમોરા પો.સ્ટેને સોંપવામાં આવેલ.



1. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.

- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ [http:// trackthemissingchild.gov.in/ missing/ index.php](http://trackthemissingchild.gov.in/missing/index.php) ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલારાપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાઇવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહિલા સુરક્ષા સમિતીની મહિલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

• ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.

- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

• ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?

- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સાઇનબોર્ડ, લગાડવામાં આવેલ છે.
- દરેક પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ ધ્વારા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ કોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ઢાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્સ્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

• અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.

- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે